

B.Com. Semester - 3 (CBCS) Examination
Nov/Dec. -2021 [NEW COURSE]
Banking & Finance - 3(Elective)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ પેમેન્ટ બેંક એટલે શું? તેના હેતુઓ અને કાર્યોની ચર્ચા કરો. (20)
 અથવા
- પ્રશ્ન-૧ મુદ્રા બેંક (MUDRA Bank) એટલે શું? તેના હેતુઓ અને લાભની સમજૂતી આપો.
- પ્રશ્ન-૨ થાપણ વીમા યોજનાની વિગતે સમજૂતી આપો. (20)
 અથવા
- પ્રશ્ન-૨ મ્યુચ્યુઅલ ફંડનો અર્થ આપી તેના પ્રકારો જણાવો.
- પ્રશ્ન-૩ બેંક ધિરાણ એટલે શું? બેંક ધિરાણના હેતુઓની ચર્ચા કરો. (15)
 અથવા
- પ્રશ્ન-૩ બેન્કિંગ નિયમન ધારો-૧૯૪૯ની વિવિધ જોગવાઈઓની સમજૂતી આપો.
- પ્રશ્ન-૪ ટુંકનોંધ લખો. (કોઈપણ બે) (15)
 A) ભારતીય મહિલા બેંક
 B) જમીનગીરીના પ્રકારો.
 C) ઓનલાઈન બેન્કિંગના ફાયદાઓ.
 D) ભારતમાં નોનબેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFCs)ઓનો વિકાસ.

ENGLISH VERSION

- Que-1 What is a Payment Bank? Discuss its objectives and functions. (20)
 OR
- Que-1 What is MUDRA Bank? Explain its objectives and benefits.
- Que-2 Explain the details of the Deposit Insurance Scheme. (20)
 OR
- Que-2 Explain the meaning of Mutual fund and its Types.
- Que-3 What is Bank Finance? Discuss the objectives Bank Finance. (15)
 OR
- Que-3 Explain the various provisions of the Banking Regulation Act-1949.
- Que-4 Write a Short note. (Any two) (15)
 A) Mahila Bank of India
 B) Types of Securities.
 C) Advantages of Online banking.
 D) Development of Non-Banking Finance Companies (NBFCs) in India.
